

સમાનો મન્ત્ર : (ગ્રંથવેદ)

સમાની પ્રપા (અથર્વવેદ)

પરબ

ઓનલાઈન

સ્થાપના વર્ષ : ૧૯૬૦

વર્ષ : ૭

મે : ૨૦૧૩

અંક : ૧૧

પરામર્શનસમિતિ

વર્ષ અડાલજા

રચિતાવાલ બોરીસાગર

પ્રફુલ્લ રાવલ

પ્રમુખ

મધ્યરથ સમિતિના સભ્ય

પ્રકાશનમંત્રી

તંત્રી
યોગેશ જોધી



ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાંગી શાનપીઠ નો ક. લા. સ્વાધ્યાયમંહિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન,
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮
ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭

Web-site : www.gujaratisahityaparishad.org


www.gujaratisahityaparishad.com

સાધને મન : | (કાંઈએક)
સાધને જ્ઞાન : | (કાંઈએક)



પરબ

લખા : વીજેશ જોગી



મે : ૨૦૧૩

વાર્ષિક : ૫

અંક : ૧૧

અનુક્તમ

(પરબ ઓનલાઈન)

પ્રમુખપદ્ધથી : નિરુદ્ધેરી, વર્ષા અડાલજા

કવિતા : પોટકુ, રાજેન્દ્ર પટેલ, ગાંધી ચાત ચીતરેલી છે, ભાવેશ ભહુ ગાંધી વરી દઈએ,
મહેન્દ્ર જોશી

વિદેશી સાહિત્ય : બ્લેકબર્નને જોવાના તેર તરીકા વોલેસ સ્ટીવન્સ,
અનુવાદ : પ્રદીપ ખાંડવાળા

સમીક્ષા-ગ્રંથાવલોકન : બારીક સંવેદનોની માવજત, હિમાંશી શેલત ગાંધી સુખપાઈ વત્તા સૂક્ષ્મ,
વિજ્ય શાસ્ત્રી ગાંધે ચડાવવા જેવી વાતાઓ : 'નાતો', નવનીત
જાની

પરિષદ-પાથેય : સંકલન : રાજેન્દ્ર પટેલ

સાહિત્યવૃત્ત : સંકલન : રાજેન્દ્ર પટેલ

(પરબ્રહ્મ પ્રકાશન)

આનુક્રમ

પ્રમુખપદ્થથી : નિરુદ્ધેશો, વર્ષા અડાલજા ૬

કવતા : પોટકુ, રાજેન્દ્ર પટેલ 10, રાજી રાત ચીતરેલી છે, ભાવેશ ભહુ 12 રાજી વેરી દઈએ, મહેન્દ્ર જોશી 12 રાજી બે રચના, સંજુ વાળા 13 રાજી ફોલ્લા, ઠિન્કુ જોશી 14 રાજી એક કાલ્ય, લાભશંકર ઠાકર 14 રાજી ગતિ નહીં બંધાય, વિનોદ ગાંધી 15 રાજી અંજળા, પ્રકુલ્પા વોરા 15 રાજી જળની તિરાડો, સાહિલ 16 રાજી પીપળો, હસમુખ ચાંગડીયા 16 રાજી મારું ઘર તો ઊડતો ગુલાલ છે, લવિત ત્રિરેણી 17

વાર્તા : અદાસ્તિ દર્શાન-5, પરંતપ દેસાઈ 18

નિબંધ : મૃગજામાં તરતો ઈશ્વરનો ચહેરો, ભારતી રાજે 34

ભારતીય સાહિત્ય : એક શિક્ષક, એક મિક્ષુક અને સંગીતનો મર્મ, જ્ય ગોસવામી; અનુવાદ : રાજેશ પંડ્યા 39

વિદેશી સાહિત્ય : બ્લેકબર્ને જોવાના તેર તરીકા વોલેસ સ્ટીવન્સ, અનુવાદ : પ્રદીપ ખાંડવાળા 48

આસ્ત્વાદ : ફુડાળાની પેલે પાર સંગતિ..., રાધીશયામ શર્મા 52 રાજી એક ગુજરાતી ગીત, એક ઉર્દૂ શેર અને એક જળસંગી ચિત્ર વચ્ચે કેટલાંક સંધાન, મુર્કુંદ આર. દારે 54

અભ્યાસ : કથાગત, સામાજિક અને સ્વરૂપ-સંદર્ભે ચાર ભીલી ગીતકથાઓ, હસુ યાઝીક 57

સમીક્ષા-ગ્રંથાવલોકન : બારીક સંવેદનોની માવજત, હિમાંશી શેલત 72 રાજી સુખપાઈ વત્તા સૂક્ષ્મ, વિજય શાસ્ત્રી 74 રાજી નજરે ચડાવવા જેવી વાર્તાઓ : ‘નાતો’, નવનીત જાની 76

પરિષદ-પાથેય : સંકલન : રાજેન્દ્ર પટેલ 80

સાહિત્યવૃત્ત : સંકલન : રાજેન્દ્ર પટેલ 86

આવરણચિત્ર : પીપુષ ઠક્કર 89

આસ્વાદનોંધ

આ અંકના લેખકો : 90

વહેલી સવાર છે. મારો લખવાનો સમય. લેખ મોકલવાની ઉતાવળ છે. સાંજની ડેલાઈન છે.

ડાઈનિંગ ટેબલ પર લખવાના કલીપબોર્ડ પર થોડા કોરા કાગળો અને પેન મુક્યાં છે. આ એની નિયત જગ્યા. સેન્ટિમીટર અને દોરાવાર માપ ગણીને જીવતા મુંબથી શહેરમાં સ્ટડીરૂમ અને રાઈટિંગ ટેબલ અમારા માટે ડિક્ષનેરીના અજાયબ શબ્દો છે, અને શાંતિ અને એકાન્ત ક્રીમતી જણાયા.

કોરા કાગળો છે, એવું જ કોરું મન. નવલકથાનાં પ્રકરણો લખાઈ જાય છે પણ નાના લેખના આરંભ રાણે પેન હાથમાં લઉં છું અને ઝર લખાતું નથી. સ્વયંસંપૂર્ણ અને પોતાનામાં જ સમાહિત નાનકડો લેખ. જીજાંશા, સાચુકલાં મોતીને વીધવું વધુ અધરું.

થોડો સમય વિચારતી રહી. રહી રહીને નજર બહાર જાય છે. બધ પદ્ધની જેમ ધીમે ધીમે પ્રભાત ખૂલ્હી રહ્યું છે. એની કોમળ, ગુલાબી અંયવાળી સોનેરી પાંદડીઓને હું ચક્કિત થઈ જોયા કરું છું. હલકીશી મીઠી સુગંધને ચાંચમાં લઈ પવનની લહેર વહી આવે છે મારી તરફ. આ તો કુદરતની આમંત્રણપત્રિકા ! હું નિરુદ્ધેશો, એમ જ નીચે ઊતરી પડું છું. આ ભૌડભર્યા મહાનગરમાં એક મોકલાશ છે મારી પાસે. ઘરથી થોડે દૂર દરિયો છે. થોડું ચાલીને એક પુલ પરથી બીજે છેડે ઊતરું કે હિલોળા લેતો અરબી સમુદ્ર ઘૂઘવે છે. વહેલી સવારે રસ્તાઓ ખુલ્લા અને શાંત છે. પુલ તો છેક જ નિર્જન છે. થોડી ડરીને ઉતાવળો ચાલું છું. નીચેથી મુંબથીની લાઈફલાઈન સમી લોકલ ટ્રેન સતત ઢોડી રહી છે. પુલ ઊતરીને આ તરફના રસ્તા પર થોડું ચાલું છું અને દેખાય છે સામે જ ક્ષિતિજ સુધી ફેલાયેલો અફાટ જળવિસ્તાર. અસંખ્ય વાર જોયેલું એ દશ્ય હજુ પણ મને રોમાંચિત કરે છે. દરિયાની સમાંતરે મરીનડ્રાઇવની ફૂટપાથ પર એની સાથે આંખથી આંખ મેળવી ચાલતી રહું છું. થોડા જોગિંગ અને ચાલવા આવેલા લોકો સિવાય ખાસ ગિર્દી નથી.

સૂરજ ઊગી રહ્યો છે. એ મેજિકલ મોમેન્ટને કેમેરામાં ફીઝ કરી લેવા પરદેશી યુગલ પાળી પર ચડીને તનમયતાથી તસવીર ખેંચી રહ્યું છે. હું પણ પાળી પર બેસી જાઉં છું અને એ અદ્ભુત દશ્યને મન ભરીને જોયા કરું છું. એકમેકમાં ગૂંઘાઈને યુગલ ચાલ્યું જાય છે. ચડતી-ભરતીનાં ઘૂઘવતાં મોઝાં તોઝાની તોખારની જેમ ધસી આવી પાળ પાછળનાં સિમેન્ટનાં બોર્ડ્સ સાથે જોરથી અથડાઈ ઊંચે ઊંચેને છે. શીતળ જળબિંદુઓનાં છાંટણાંથી મારું મન ભીજાય છે. હું થોડી આગળ ખસીને બેસું છું.

ભરતીનાં મોજાંનો વેગ વધ્યો છે, મને ક્યાંની ક્યાં લઈ જાય છે કોઈ જુદા સમયખંડમાં !

પણા-મમ્મી અને બહેન ઠિલા અમે સૌ એમ જ રખડવા નીકળી પડેલાં. નહીં કોઈ ડામઠેકાણું, નહીં ક્યાંય બુકિંગ. માત્ર આવવા-જવાની ટિકિટ. એક મહિનો ગંગા-યમુનાને કાંઠે રહેવાનું. છેલ્લો મુકામ હરદ્વાર. અહીં તો અમે અઠે હી દ્વારકા કરીને રહ્યા. ગંગાકંઠે નાનું ઘર ભાડે લીધું. રોજ સાંજે હરકીપેરી પર નિરાંતે બેસીને ગંગાઆરતીનાં દીપદર્શન કરીએ.

બે જોડી કપડાં, થોડું ખાવાનું લઈ આજુબાજુની જગ્યાઓમાં મન ભરીને રહડીએ. મસૂરી, દહેરાદૂન, ગંધકના ધોધની ખીંચ જ્યાં ગમી જાય ત્યાં રહેવાનું. ફરી તેરાતંબુ ઉઠાવીએ એમ એક વખત દેવપ્રયાગ ગયાં. દેવપ્રયાગ પાસેના રસ્તે ઉતારી બસ તો ચાલી ગઈ. દેવપ્રયાગ અલકનંદા અને ભાગીરથીના સંગમ પરની બેખડો પર વસેલું ગામ. દૂર સુધી દેખાતી ગિરિમાળાઓ, ધસમસતી નદીઓએ બેખડોને કોતરી નાંખી છે. બેખડ પર ઊભા રહી વંદન કરતા મગરનાં વિશાળ વિકરાળ જડબાં ખુલ્લાં હોય એવી ભવ્ય ભયાનક સુંદરતા દેખાય. કુદરતે જળના ટાકણે કંડારેલું અદ્ભુત શિલ્પ !

પર્વતમાળા પાછળ સૂરજ ઉત્તરી ગયો અને બપોર ઉત્તરતાં ધેરી રાતનો અંધકાર. હવાની જેમ ફેલાઈ ગયો. નાનું ગામ ઠંડીમાં વહેલું ઊંઘી ગયું. ત્યારે ટી.વી. નહોતાં અને અત્યાર જેટલી જ્યુ, ટેક્સીઓ દોડતી નહોતી. ધેરો અંધકાર, નિઃસ્તબ્ધ શાંતિ અને ભેંકાર નિર્જનતા. પણા-મમ્મી શોહ પામી ગયા. યુવાન પુત્રીઓને લઈને આખી રાત ખુલ્લામાં, રસ્તાની ધારે બેસી રહેલું ! પર્વતોના જોખમી સર્પાકાર રસ્તાઓ પર સાંજ પછી વાહનોને જવાની બંધી એટલે રડયુંખડયું વાહન કે મુસાફર મળવાનીયે કોઈ શક્યતા નહીં. મમ્મીની આંખ ભીની થઈ ગઈ. આમ જ રખડવા ન નીકળ્યા હોત તો !

પણા ખૂબ સ્વર્ણ અને શાંત.. એ એક ખડક પર ધ્યાનસ્થ સ્થિતિમાં બેસી રહ્યા. એમના હોઠ ફંડતા હતા. નિરવ શાંતિમાં યા દેવી સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા..... શ્લોકનો લયબદ્ધ સ્વર ધીમો ગુંજ રહ્યો. સમય નદી સાથે ખળખળ વહેતો રહ્યો.

એકદમ દૂર અંધકાર. પીળા ઝાંખા પ્રકાશનું નાનું સરખું જૂમખું જૂલતું દેખાયું. પણાએ આંખો ખોલી અને સામે આંગળી ચીધી અને જવાની તૈયારી કરતા હોય એમ થેલો ખલે ભરાવ્યો. પ્રકાશ જૂલતો જૂલતો બેખડ ચડીને અમારી તરફ આવ્યો. ક્ષાનસ લઈને એક વ્યક્તિ અમારી પાસે આવીને ઊભી રહી. ક્ષાનસ ઊંચું કરીને અમને જોયા, મીઠાશથી પૂછ્યું,

“બાબુજી, આપ યાત્રિક લગતે હો. આશરા ચાહિયે તો હમારી સાથ હમારી ધરમશાલામં...”

અમે સ્તબ્ધ. એણે હસીને કહ્યું,

‘આઈયે, સોનેકી સુવિધા કર દૂંગા.’

હા-નાનો પ્રશ્ન જ ક્યાં હતો !

જાણો કોઈએ સ્નેહથી તેદું કર્યું હતું. અમને હાથ પકડી સંભાળીને વિકરાળ બેખડ પરથી લઈ જઈને ગામમાં લઈ ગયો. કેદીથી ચાવી કાઢી એક નાના સરખા ઘરનો દરવાજો ખોલ્યો. લાકડાંનાં જૂનાં કમાડ ધક્કા સાથે ખૂલ્યી ગયાં. એવો જ જીર્ણશીર્ણ બારણાં તુટેલો ભીંતકબાટ. એમાંથી મોટી શેતરંજી અને ઓશીકા કાઢી પાથરણું પાથર્યું. ખીટીએ ભરાવેલું બીજું ફાનસ ઉતારી વાટ પેટાવી એક તરફ મૂક્યું.

એના આધાશા શાંત પ્રકાશમાં એ વ્યક્તિને અમે જોઈ. દૂબળું ઝીણું હડ, થોડી ફાટેલી ચાદર વીંગેલી, કાબરચીતરી દાઢી અને જુકેલી પીઠ.

પણાએ પૂછ્યું, “આપ બસસ્ટેન્ડ પર રાતકો કેસે આ ગયે ?”

એણો ડોકુ ધુશાયું. ફાનસની વાટ થોડી નીચી કરી.

“બસસ્ટેન્ડ પર હંમેશાં યજમાન હુંઘનેકો આતા હું હો દિનસે ઠીક નહીં. સો ગયા થા. પતા નહીં કર્યા હુआ, નીંદ ઉડ ગઈ. લગા કે કોઈ અંતિમ બસમેં ઉત્તર કે રાસ્તે પર બેઠે હો, તો કર્યા કરેંગે વો લોગ ? ઉઠ ગયા. પત્નીને યોકા, ઠડ હૈ સો જાઓ. બાબુજી, મેરા મન નહીં માના. યજમાન સેવા હમારા કામ ભી હૈ, ધરમ ભી. કોઈ કુંગ કબીલાવાવા હોગા તો ઉસે તકલીફ હોગી.” પણાથી બોલાયું નહીં. “ધન્યવાદ” કહેતાં હાથ જોડ્યા. એણો ઉત્સાહથી કહ્યું.

“બાબુજી, આપ આરામ કીજિયો. થક ગયે હોંગે, ખાના તો ઈસ વકત નહીં હૈ, મૈં ગરમ ચાય લે કે આતા હું.

એણો બંધ ઓરડાની હવડ બારી ખોલી. બારી ખૂલતાં જ ઇન્દ્રલોકની શોભાને જાંખી પાડે એવું અદ્ભુત દશ્ય જોયું. અમે અવાક્ર !

ભાગીરથી અને અલકનંદાના સંગમની બેખડ પર ગોરનું નાનું શું ઘર. વાદળોનો અંતરપટ ખસેડી ચંદ બહાર આવી ઉંચે ચડી રહ્યો હતો. શાંત ભાગીરથી અને ધસમસતી અલવડ અલકનંદા. બંનેના જોશભેર ટકરાવથી ઉંચે ઉછળતી છોળથી જળસ્તંભ રચાતો હતો. દૂર સુધી પથરાયેલી નિરિમાળાઓ, એની ગોદમાં શિશુ જેવું પોઢી ગયેલું ગામ, પ્રચંડ ઊર્જા લઈ ધસી આવતી નદીઓ બેગી થતાં ઉંચે ઉડતો જળજીવારો અને રૂપેરી ચાંદનીમાં નહાતું સમગ્ર દશ્ય !

બારીની નીચે નાના કોતરેલા થાંભલાઓ. એક સમયે જ્યારે પદયાત્રીઓ આ રસ્તેથી જતા હશે ત્યારે આ જાહોજલાલીવાળા આવાસનો આ ઝરુખો કેટલો સુંદર હશે ! જીર્ણશીર્ણ આ ગવાક્ષ જાણે હજી કોઈ રૂપવતી રાણીની પ્રતીક્ષા કરતો હશે !

અમે તો ત્યાં જ બેસી પડ્યા. હવે કેવી નીંદર ને કેવો આરામ ! ગોર મહારાજ ગરમ ચાની કીતલી અને બેત્રાણ રકાણી આપી ગયા. અમારા થેલામાં થોડો નાસ્તો તો હતો. આવી ઉજાણીનો લહાવો ફરી કર્યારે મળે ? અમે સંગમની સામે ગોખમાં બેસી રહ્યાં. મમ્મી હલકબર્યે કંઠ ગાતી હતી,

વા વાયા ને વાદળ તિમટ્યા,
ગોકુળમાં ટહુક્ક્યા મોર,
મળવા આવો સુંદિરવર શામળિયા.

પણ એમના ધૂંટાયેલા ઘેરા સ્વરે જગન્નાથનું ગંગાલહરી ગઈ રહ્યા હતા :
સુધાસૌદર્ય તે સલિલમશિવં નઃ શમયતુ ।

હે મા ! તારું અમીજણ સમગ્ર પૃથ્વીનું સૌભાગ્ય ગણાય છે, તે અમારું અમંગલ,
પાપનું શમન કરો.

મોરી રાત સુધી અમે ઝરુણે બેસી શ્લોકો અને ગીતો ગાતા રહ્યા. વહેલી સવારે
અમારો દેવદૂત હાજર. અમને સંગમધાટે લઈ નદીનાં પૂજન-અર્ચન કરાવ્યાં. ચા-નાસ્તો
કરાવી સમયસર બસને સમયે અમને બસસ્ટેન્ડે પહોંચાડ્યાં. એમણે દક્ષિણા મારી નહીં,
અમે આપી.

વાટેઘાટે વળાંકે જીવન વહેતું રહ્યું. કદીક ઘેરા અંધકારમાં રસ્તાની ધારે સૂનમૂન
ઊભી રહી છું ત્યારે મમ્મીએ અત્યંત શ્રદ્ધાથી શામળિયાને પાડેલો સાદ સંભળાય છે,
પણાનો યા દેવી સર્વભૂતેષુ સ્વર દૂર વાગતા ધંટનાદની જેમ મારા મનમાં ગુજે છે.

રાજ્યપથ છોરી જે સહજ ભાવે નાની કેરીએ ચાલતો રહે છે ત્યારે અપૂર્વ, અજાણ્યાં
સૌંદર્યસ્થાનો ઊઘડતાં આવે છે. હરીન્દ્રભાઈની એક કાવ્યપંક્તિ મને બહુ ગમે છે,

અટકીને હર વળાંકે, પૂણું છું સર્વને,
અહીંયાંથી તમને યાદ, કદી જિંદગી ગઈ ?

પોટકુ | રાજેન્દ્ર પટેલ

પોટકુ પડ્યું પડ્યું
વાગોળે છે અંદરનું અંધારું
અને માણે છે પ્રતીક્ષાનો પ્રકાશ.
જન્મોજનમથી
ખૂલવાની, ખાલી થવાની
એ રાહ જુઓ છે.
આસપાસના નાનાં નાનાં પોટકાંઓને
અને આવજા કરતા લોકોને
એ જોઈ રહે છે.
કોઈ ગાંઠ ખોલે એની રાહ જોતાં
અને સમજાય છે
વાસ્તવમાં પોતે જ ખોલવાની હોય છે
પોતાની ગાંઠ.



પોટકુ બનતું
બાનાં જીર્ણ સાલ્લામાંથી
અથવા બાપુજીના ઘસાઈ ગયેલા ધોતિયામાંથી
એટલે જ કદાચ
ઝીચોખીય ભરેલું હોવા છતાં
પોટકુ કયારેય ફસકાર્યું નથી..



પોટકુ
સમયે સમયે, સ્થળે સ્થળે
પડ્યું હોય છે
ઘરમાં, શેરીમાં, સીમખેતરમાં
અથવા ખેટક્ષોર્મ, બસસ્ટેન્ડ કે ફૂટપાથ પર,
પણ જ્યારે જ્યારે રહેલું બાના માથે
એ શોભતું કોઈ મુગટની જેમ.

એથી જ કદાચ પોટલું ઊંચકી જતી દરેક સ્ત્રી
મા જેવી લાગતી હોય છે.



કોઈ આવીને ઉતારે માયેથી પોટકું
એની રાહ જોઈને ઉભેલી હરેક વ્યક્તિ
મારા જેવી લાગે છે !
ટ્રેનમાં, બસમાં, કારસમાં હોવા છતાં
લાગે છે જાણે
એક નહીં અનેક અદશ્ય પોટકાઓનો
ભાર વેંફરીને જીવવાની આદત પડી છે.
પોટલું શિખવાડે છે કેમ ભાર સાથે હલકા રહેલું.



ગમે ત્યાં, ગમે ત્યારે
એને ગોઠવવામાં આવે
એ ગોઠવાઈ જાય છે
બાની જેમ..
કપાસની કે ચારની ગાંસડી
જાણે ખેતરને ઘરે લાવતી
અને ઘરને ખેતર લઈ જતી.
હવે ખેતર, ઘર અને ગાંસડી કશું નથી
એક કાળ પોટકું પડ્યું છે સ્મરણમાં.



પોટકાને કશણી જરૂર હોતી નથી
ચડાવનારની કે ઉત્તરાવનારની
એને જરૂર હોય છે એક વિસામાની
ગામપાછર હોય છે એવો..
પોટકું માને છે
પોતે જ છે પોતાનો વિસામો.



બાળપણમાં બા જોડે
ધાણી સ્નોડાવવા જતો
તંદુલની પોટલી જેવડી નાનકડી પોટકી

મોટું પોટકું બની જતું જોઈ
મા, કૃજા જેવી લાગતી.



હે પરદેશ જતી દીકરીને
મસમોટી બેગો વચ્ચે એના અસભાબ સાથે જોઉં છું ત્યારે
એક નાનકડી પોટકી
એવી ભીતર પાંગરતી જોતો હોઉં છું.



ખૂલીને ફરી ફરી બંધાતું
એક વાર બંધાયા પછી કદી ન ખૂલતું, પોટકું
મારા જેતું કેમ લાગતું હશે ?



પોટકું
કદી પોતાને માત્ર પોટકું બનવા હેતું નથી
ગાંઠ કઢાય ખૂલે પણ ખરી.

ચાત ચીતરેલી છે | ભાવેશ ભણ

ચાત ચીતરેલી છે,
બાતમી મળેલી છે.
વૃક્ષ આપડો માટે !
પંખીની હવેલી છે.
એક છબી છું હું કેમાં,
પ્રાર્થના મઢેલી છે.
આ તું શું ઉકેલે છે ?
ગુંચ કચ્ચાં પડેલી છે ?
હું સ્મરણ કહું એને !
જે ક્ષણો સરેલી છે.
એક વાર બોલ્યો'તો,
નસ હજી ચઢેલી છે.
જિંદગી, અભણ છું હું,
તું બહુ ભણેલી છે !

વેરી દઈએ | મહેન્દ્ર જોશી

શુજ પજોં હવે જેરી દઈએ
બીજ બે-પાંચ છે વેરી દઈએ.
કોઈ મણી નીકળી પડે ત્યાંથી,
ચાલ સાગર ફરી તેરી દઈએ.
ખૂલ સુંદર સરસ ચરણ નાના,
ઊંઝરી ઝીણી રૂપેરી દઈએ.
ઓંખ સહુની ઉદાસ લાગે છે,
સ્વઘન થોડાંક ઉમેરી દઈએ.
ભીત લોચી થઈને છો જુઓ,
કાન એનાય ભંબેરી દઈએ.
જો મળીશું તો હુંબ વધી જાશો,
પ્રેમ અહીંયાં જ વિભેરી દઈએ.
જોશીનું ગર્વ ઉતરી જાશો,
તેને એવો જ નામેરી દઈએ.

વિદેશી સાહિત્ય બ્લોકબર્ડને* જોવાના તેર તરીકા

વોલેસ સ્ટીવન્સ
અનુવાદ : પ્રદીપ ખાંડવાળા

૧

વીસ હિમાચાદિત શિખરો વચ્ચે
એક જ હલતી વસ્તુ હતી
બ્લોકબર્ડની આંગ.

૨

હું ત્રણ મતનો હતો....
ત્રણ બ્લોકબર્ડ જેની ઘટામાં હોય
તેવા વૃક્ષ જેવો....

૩

પાનખરના વાયરામાં બ્લોકબર્ડ ચકરાતું હતું.
મૂક્નાટકનું આ નાનકું અંગ હતું.

૪

સ્ત્રી અને પુરુષ
એક છે.
સ્ત્રી, પુરુષ અને બ્લોકબર્ડ
પણ એક છે.

૫

મને વધુ પસંદ શું છે એ ખબર નથી :
સૂરના પલટાઓનું લાવજ્ય
કે એમના ઈશારાઓનું સૌંદર્ય,
બ્લોકબર્ડની સિટી
કે એની પછીની પળ.

૬

હિમ-કશિકાઓએ
લાંબી બારીને ભરી દઈને
એના કાચને બાર્બર બનાવી દીધો હતો.

* યુરોપ, એશિયા અને અમેરિકાનું ગાતું પક્ષી

બ્લોકબર્ડનો પડછાયો
બારીની એકથી બીજી બાજુ ફરકી રહ્યો હતો.
પડછાયાની મનઃસ્થિતિ
અકળ ઉદ્દેશને
અંકિત કરી રહી હતી.

૭

હેણામના^x ઓ કૃશ પુરુષો
તમે સોનેરી પંખીઓને શીદને કલ્યો છો ?
જોતા નથી કઈ રીતે
બ્લોકબર્ડ તમારી
આસપાસની સ્ત્રીઓના પગ ફરું
ઠેકી રહ્યું છે ?

૮

હું ઉમદા સ્વરભાર જાણું છું
અને અનિવાર્ય સ્પષ્ટ લયો પણ;
પણ એ સુધ્યાં જાણું છું કે
મારી અભિજામાં
બ્લોકબર્ડ સમાયેલું છે.

૯

જ્યારે બ્લોકબર્ડ દસ્તિમાંથી વિવોપ થયું
ત્યારે અનેક વર્તુળોમાંનાં એકની કોર
એકો આંકી હતી.

૧૦

હરિત પ્રકાશમાં ઊડતા બ્લોકબર્ડને જોતાં
મધુર ગણિકાઓ પણ
તીવ્ર આશ્ર્યોદ્ગવાર કરી લેસો.

૧૧

કાચના કોચમાં
કનેક્ટિકટમાં એ ફરી આવ્યો.
એક વાર જ્યારે એને
ભાંતિ થઈ કે

^x અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આવેલો એક કસબો.

કોચના સરસામાનના પડછાયા બ્લેકબર્ડ છે
તો એ છળી મર્યો.

૧૨

નદીમાં હલગલ....
બ્લેકબર્ડ જરૂર ઉડતું હશે.

૧૩

આખી બપોર સંધ્યા જેવી રહી.
દિમ વર્ષ ચાલુ હતી
ચાલુ રહેવાની હતી.
બ્લેકબર્ડ દેવદારના અવયવોમાં
વસી રહ્યું.

સ્ટીવન્સ (૧૯૭૮-૧૯૮૫) સંપન્ન કુટુંબમાં જન્યા હતા. પિતા સફળ વકીલ હતા. સ્ટીવન્સ હાર્વર્ડમાં ભાડ્યા અને પછી વકીલાતનું ભાડ્યા. આજીવન સફળ વકીલ તરીકે કંપનીઓમાં કામ કર્યું અને ઉચ્ચપદો પર રહેલા. એમને પુલિ પુરસ્કાર અને બે વાર નોશનલ બુક અવોર્ડ મળેલા. વિભાવનાઓના કવિ તરીકે વિવેચકોએ એમને ઓળખાવ્યા છે. એ આધુનિકતાને વરેલા હતા. વિવેચક હોરલડ બ્લૂમે એમને એમના વખતના અમેરિકાના સૌથી ઉત્તમ અને નમૂનારૂપ કવિ તરીકે નવાજ્યા છે.

સ્ટીવન્સનાં આ તેર લઘુકાવ્યો minimalist (અલ્પતાવાદ)ના ઉત્તમ નમૂનાઓ છે. કવિતામાં જવલ્યે જ જોવા મળે એવી કશીક પરિચિત વસ્તુમાં કાવ્યની શક્યતા જોવાની કેટલી સફળ રીતે કવિએ બતાવી છે ! દરેક કાવ્ય એક ચિત્ર જેવું લાગે, જ્ઞાને કે કોઈ જાપાની ચિત્રકારે બ્લેકબર્ની જુદી જુદી હરકતો થોડીક જ લીટીઓને આધારે દોરી હોય. આ તેર કાવ્યોમાં ભાવ તો પ્રકૃતિ-સૌંદર્ય માટેના પ્રેમનો છે, પણ લાગણીવેડા વગર, તટસ્થતાથી દર્શાવવાયો છે. ક્યારેક ક્યારેક મનુષ્ય-સ્વભાવને પણ આંક્યો છે. કવિતામાં સર્જનાત્મકતાનો વિચાર કરીએ તો આ કાવ્યો બતાવે છે કે જે આપણને જાળીનું છે તેને કલ્યાણનાને આધારે અપરિચિત રીતે દર્શાવવામાં સર્જનાત્મકતાનો એક પ્રમુખ ઝોત સર્જને ઉપલબ્ધ થાય છે. આ કાવ્યોમાં આપણા રસશાસ્નીઓએ ‘ધ્વનિ’ કહ્યો છે એનો કવિએ ઉત્તમ વપરાશ કર્યો છે. નાણ દાખલા ટાંકવા જેવા છે :

‘વીસ દિમાચ્છાદિત શિખરો વચ્ચે
એક જ હલતી વસ્તુ હતી
બ્લેકબર્ની આંખ.’



‘સ્ત્રી અને પુરુષ
એક છે.
સ્ત્રી, પુરુષ અને બ્લોકબર્ડ
પણ એક છે.’



‘નહીમાં હલચલ...
બ્લોકબર્ડ જરૂર ઊર્ધ્વનું હશે.’

નોંધ : અનુવાદમાં મદદ બદલ દક્ષાબહેન અને રાજેન્દ્રભાઈ પટેલ, લીનાબહેન ત્રિરેઠી અને શ્રી હસમુખ શવળનો આભાર.

બારીક સંવેદનોની માવજત | હિમાંશી શેલત

[પાછા વળવું : વીનેશ અંતાણી, પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રા. લિ., અમદાવાદ-મુંબઈ, પૃ. ૧૬૬, ડિ. ૩. ૧૨૫/-]

‘શબ્દસૂચિ’ના વાર્તાકારોની ડેફ્ઝિયતવાળા વિશેપાંકમાં વીનેશ અંતાણીએ વાર્તાસર્જનને મોતના ફૂવામાં મોટરસાઈકલ ચલાવવા જેવા જીવસ્ટોસ્ટ કામ દેખે ઓળખાવેલું. વાર્તા સર્જવાની પ્રવૃત્તિની ગંભીરતાનો આવો પરિચય મેળવવો ગમે.

પંદર વાર્તાઓને સમાવતા વીનેશ અંતાણીના તાજા સંગ્રહ ‘પાછા વળવું’માં એમની વાર્તાકાર તરીકેની લગભગ તમામ લાક્ષ્ણિકતાઓ પ્રતિબિંબિત થઈ છે. સ્ત્રી-પુરુષસંબંધના સંવાદ અને વિસંવાદની આસપાસ, એકલતાની વિધાદગ્રસ્ત પળો, જીવનમાં અચાનક આવી જતા તનાવ, તથા પ્રલંબ મનોમંથન પદ્ધીના નિર્જયાત્મક તબક્કાઓ અહીં આવેખાયા છે. આ પંદરમાંથી અગિયાર વાર્તાઓ દાંપત્ય જીવનનાં ઉતાર-ચડાવ અને પડાવ-નાત્રા જેવાં વિવિધ સ્થિત્યાંતરોને ગુંઘે છે. સર્જકનો મુખ્ય રસ માનવમનનાં અતલ રહસ્યોમાં છે અને પ્રેમ સ્વયં જીવનનું મોટામાં મોટું રહસ્ય હોવાથી ફરીફરીને આ વાર્તાકાર એ વિષયસામશ્રી તરફ ખેંચાતા રહે છે. માનવસંબંધોમાં નિયતિ પણ એક સશક્ત પરિબળ છે, અને એ કારણે ઉત્પન્ન થતી વિષમ પરિસ્થિતિના ચિત્રણમાં વાર્તાકારનાં સૂજુ-સંયમ ‘સાંકળથી બાંધેલી’ જેવી રચનામાં વિશેષ ધ્યાનપાત્ર બને છે. પરિવાર માટે જિંદગી હોમી દેનાર પતિના અવસાન પણી એની સ્ત્રી માથે આવી પડેલી જવાબદારીમાંથી જાતને અળગી કરી શકતી નથી. પુરુષ તો મરીને મુક્ત થઈ ગયો છે, હકીકતમાં જીવિત પત્ની જ મૃત્યુ પામી છે, જે ઘર સાથે સાંકળે બંધાયેલી છે, અને બંધનાવસ્થામાં જીવવાની છે.

જીવન-પ્રવાહ ક્રયાંયે, કોઈ માટેયે થોભતો નથી એ સનાતન સત્ય ‘એમની જિંદગી’માં પ્રભાવક રીતે ઉપસ્થું છે. પિતાની સાથે નિકટતા અનુભવી ન શકેલો પુત્ર બેંગલોરમાં નોકરી કરે છે, એજો પોતાની પસંદગી અનુસાર લગ્ન કર્યા છે અને પિતાએ પણ આ સંદર્ભ પૂરી તટસ્થતા દાખલી છે. હવે આ પિતા એકલા પડ્યા છે, માના મૃત્યુ પછી પિતા પોતાની સાથે રહે એવી ઈચ્છા પુત્રના ફરજ-ભાનમાંથી જન્મી છે. પૂરી કર્તવ્યનિષ્ઠ સાથે એ પિતાને સમજાવવા અને સાથે લઈ જવા આવ્યો છે, પણ પિતા નિજ જિંદગી જીવવા સમર્થ છે અને એમના જીવનમાં દામની ભાવે નામની સ્ત્રી પ્રવેશી ચૂકી છે. પુત્ર-પુત્રવધૂ સાથે એ જીવવાના નથી. વાર્તાના મર્યાદિત ફલક પર પાત્રોની

વિલક્ષણતા સમેત પ્રવહમાન જીવનનું આ માર્ગિક ચિત્ર આસ્વાદે છે.

એ જ રીતે ‘માધવીની વાર્તા’માં નવપરિશીત માધવીના અનુભવનું આવેખન હૃદયબેદક છે. વાર્તાનો અંત જાણે વાર્તાનો આરંભ બની રહે છે. લગ્ન થઈ ગયા પછી સ્ત્રીના પૂર્વજીવનના નિર્માણ ઉચ્છેદની તીવ્રતમ વેદનાનું આ ચિત્ર ક્ષુભ્રતાપ્રેરક છે. બધી રીતે સફળ, પ્રેમાળ અને યોગ્ય દેખાતો પુરુષ પણ નવવધૂને માટે હતાશા અને ઉંડી પીડાનું કારણ બની શકે એ વાસ્તવિકતા અહીં ધારદાર પ્રગટી છે.

સ્થળના ચિત્રાંકનમાં વીનેશ અંતાણી આરંભથી જ અસરકારક રહ્યા છે. એમજો આવેખેલાં દશ્યો વાર્તાના વાતાવરણ માટે ઉપકારક નીવડે છે. ટેકરીઓ પાછળ ઊતરતો સૂરજ, પવનના ધક્કે ડેલતી સૂક્રી ડાળીઓ, તળોટીમાંથી નીકળતી અને પહાડ ઉપર પહોંચતાં પહેલાં ગુમ થઈ જતી વાટ, ગોરંભાયેલું આકાશ અને ઝરભર વરસાછ, સંધ્યાકાળની અંધારા-અજવાળાની લીલા અને આંગણામાં લંબાતા પડછાયા, વાર્તાંકથનને સહાયક બને એમ ગુંથાતાં આવે છે. આવી વિગતો વધારાની નથી બનતી, કે નથી બનતી એ બોજારૂપ.

જોકે એમ સામાન્યતઃ બનતું આવ્યું છે તેમ, સંગ્રહની બધી જ વાર્તાઓને એકસરખી માવજતનો લાભ નથી મળ્યો. વાર્તારચના ‘નિર્ણય’ એની નિશ્ચિત દિશા તરફ ગતિ કરતાં કરતાં ઠીક ઠીક શ્રમ અનુભવતી જગ્યાય છે, તો વળી ‘બોગડું’ની તાજી કૃત્રિમ લાગે છે. ‘સાક્ષાત્’નું કથાબીજ રસપ્રદ છે, પરંતુ એની માવજત વધુ કાળજીની અપેક્ષા રાખે. મંદિર અને દેવપૂજા સાથે સંકળાયેલા રૂઢિચુસ્ત પારિવારમાં પ્રવેશતી જ્યશ્રી અને એના પતિ અમૂલ્ય વરચેનો સૂક્ષ્મ વિસંવાદ વાર્તામાં પ્રગટ તો થાય છે, પણ એની તીવ્રતા પૂરેપૂરી વ્યક્ત નથી થઈ શકી.

બે પાત્રોની કિયા અને પ્રતિભાવો વરચેના અવકાશનું અવતરણ વાર્તામાં કેવી રીતે થાય છે એ નીરખવાની ઉતેજના આ વાર્તાઓમાંથી પસાર થતી ભાવકને સાંપડશે. આનાં અનેક ઉદાહરણો સંગ્રહમાંથી મળી આવશે. જે ખાસ ઉલ્લેખનીય લાગ્યું તેવું એક અહીં પ્રસ્તુત છે :

વાર્તાનું શીર્ષક છે ‘માધવીની વાર્તા’, જેની અગાઉ નોંધ લીધી છે. નાયિકા પહેલી વાર વેરવળથી હૈદ્રાબાદ એના પાત્ર હેમંત સાથે જઈ પહોંચી છે. જુઓ આ દશ્ય.

“વાસ્તુપૂજન કરાવી લીધું ?” માધવીએ પૂછ્યું.

“વાસ્તુપૂજન ?”

“આ નવા ફ્લેટનું ?”

“ના. કેમ ?”

“આપણે બધાંને અહીં બોલાવીશું ?”

માધવીના અવાજમાં અણધાર્યો ઉત્સાહ આવી ગયો.

“કોને ?”

“વેરાવળથી. તમારાં-મારાં ઘરનાં... હોશથી આવશે બધાં.”

“ના રે ના ! એ ધાડાને રાખવાં ક્યાં ?”

“ધાડાં ?”

હેમતે સિગારેટનું દૂંહું બાલકનીમાંથી નીચે ફેંક્યું. માધવી નીચેની તરફ પડી રહેલા સફેદ ટુકડાને જોતી રહી.

આ ઉપરાંત ‘નાની અને પઢી મોના’ ‘જાળું’ અને ‘પાછા વળવું’ વાર્તાઓ એનાં સૂક્ષ્મ સંવેદનોની અભિવ્યક્તિને કારણે માણવી ગમે એવી થઈ છે.

બાવીસેક નવલકથાઓ આપી ચૂકેલા વીનેશ અંતાણી આમ તો પૂરા નવલકથા ભણી વળી ગયા હોય એમ વરતાય, તોયે વખતોવખત એમને વાર્તા તરફ પાછા વળવાનું ગમે છે એ રજી થવા જેવી બાબત. એમનો આ પાંચમો વાર્તાસંગ્રહ વાર્તાચાહકોને નિરાશ નહીં કરે.

સુખપાઠ્ય વત્તા સૂક્ષ્મ | વિજય શાસ્ત્રી

પ્રતિબિંబ (વાર્તાસંગ્રહ) : લેખક : નીલેશ રાણા, પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. વિ., પ્ર. આ. ૨૦૧૧, પૃ. ૮૧૫૨ = ૧૬૦ ટિક. રૂ. ૧૫૦/- ૧૦ ડોલર (એરમેલથી)]

આ સંગ્રહના લેખક નીલેશ રાણા વ્યવસાયે તબીબ છે. રહે છે અમેરિકામાં. આ પૂર્વે એક વાર્તાસંગ્રહ અને પાંચ નવલકથાઓ તેમના નામે જમા બોલે છે. સંગ્રહમાં કુલ ત્રૈવીસ વાર્તાઓ છે. એમાંની ‘તૃપ્ત’ જેવી એકાદને બાદ કરતાં મોટાભાગની અમેરિકાના લોકાલમાં આવેખાયેલી છે. બહારથી, ખાસ તો ભારત અને ગુજરાતમાંથી અમેરિકા જઈને વસેલાં માનવીઓ આ વાર્તાઓના કેન્દ્રમાં છે. તાજેતરનાં વર્ષોમાં પોતાના મૂળ વતનમાંથી અન્યત્ર જઈ વસેલી પ્રજાના સાહિત્ય માટે Diaspora સંજ્ઞા ચલણી બની છે અને આવા વિશિષ્ટ સાહિત્યને વ્યાખ્યાયિત કરી તેનાં સ્વરૂપલક્ષણો અંગે સંશોધનો પણ થયાં છે. વેબસ્ટર ડિક્શનરીમાં આ સંજ્ઞા માટે to scatter અને to sow એવા બે (બીજા અર્થો સાથે) અર્થો આયા છે. (જુઓ ૧૯૭૧ની આવૃત્તિ : પાનું ૨૩૦.) ‘વેરવિભેર થયું’ અને ‘ફેલાઈ જવું’ એવો ગુજરાતી તરજૂમો કરીએ તો તે આ વાર્તાઓનાં પાત્રોની વાર્તર્ક ઓળખ બની શકે. નવા સમાજની ગતિવિધિ સાથે અનુકૂલન સાધવાની જે તીવ્ય મથામણ આ પાત્રો અનુભવે છે તેનું વાર્તા રૂપે (રિપોર્ટ : ‘વાર્તા’ રૂપે) આવેખન થયું છે. આ મથામણોના લેખક સ્વયં સાક્ષી છે તેથી તેમાં અપરોક્ષતા આવી શકી છે. જેર, આ તો થઈ દસ્તાવેજ વાત. મૂળે તો વાર્તાના વચાકમાત્રને અપેક્ષા છે વાર્તા-રસની અને એ પૂરી પાડવામાં આ વાર્તાઓ સફેદ રહે છે.

પૂર્વેમિકાને ભૂલી ન શકતો કેતન, પત્તી શ્રેયાને ખરા દિલથી ચાહી શકતો નથી.

અક્સમાતું પૂર્વીમિકા સ્વાતિને પોતાના પતિને ચાહતી જોવાનો પ્રસંગ ઊભો થાય છે અને તે ઘટના કેતનને પોતાની પત્ની તરફ પાછી વાળે છે ત્યારે શ્રેયા તેની પર આવતા સહનુભૂતિના શબ્દોવાળા ઝેન માટે ‘રોંગ નંબર’ શબ્દો બોલે છે જે પલયાયેલી પરિસ્થિતિનું સરસ પ્રતિનિધિત્વ કરે છે.

નારીસંવેદના એકાધિક રચનાઓમાં તારસ્વરે પ્રગટ થઈ છે. ‘નિર્જય’ની નિયતિ પતિ પરેશને છોડી પિયર આવી ગઈ છે. આ જ સ્થિતિ ભૂતકાળમાં તેની માતા વસ્તુંધરા માટે પણ સરજાઈ હતી. પણ ‘ત્યારે તું (નિયતિ) મારા પેટમાં હતી... તારી જવાબદારીએ મારાં પગલાં રોક્યાં.’ (પૃ. ૩૧) બે સ્ત્રીઓ સમસ્યા એકસરખી છતાં નિર્જયો જુદા. કારણ ? બંને સ્ત્રીઓની પરિસ્થિતિ જુદી છે.

‘હુંફું’નો જ્યોર્ધ્ન, પત્ની ત્યુસી તેને છોડીને ચાલી ગઈ હોવાથી એકલવાયું જીવન જીવે છે. આ ત્યુસીના મૃત્યુના સમાચાર તેને સ્પર્શી શકતા નથી પણ તેના એકલતાસભર જીવનના એકમાત્ર સાથી એવા ‘ડોંગ’ ત્યુસીના મરણના સમાચાર તેને હચ્યમચાવી જાય છે. માનવી કરતાં પશુની ‘હુંફું’ તેને વધુ હતી એ વક્તા આસ્વાદ બને છે.

‘પ્રોમિસ’ રચના તો એક સ-રસ, સબળ, સફળ એકાંકી બની શકે એવી પ્રસંગયોજના અને તજજન્ય નાટ્યાત્મકતાથી સભર છે. પત્નીના મરણ બાદ પુત્રી વેરોનિકાના એકમાત્ર સહારે જીવન વ્યતીત કરતા મિ. વિલ્સન માટે કટોકટી ત્યારે સરજાય છે, જ્યારે દીકરી કિડની ફેલ્યોરથી મરણાસન્ બને છે. તેને બચાવવા પોતાની કિડની ‘મેચ’ પણ થાય છે પણ તેના શરીરમાં (વિલ્સનના શરીરમાં) ફક્ત એક જ કિડની છે એટલે તે કાઢી શકાય એમ નથી. આથી વાર્તાન અંતે પિતા પુત્રીને આપેલું પ્રોમિસ પાળી બતાવવા આત્મહત્યા કરે છે. સંવાદો, પરિસ્થિતિઓનું નિર્વહણ તેમજ રહસ્યની ગૂંથણી ‘પ્રોમિસ’ને ઉપર નોંધ્યું તેમ સરસ એકાંકી બનવાની શક્યતા પૂરી પાડે છે. વાર્તાંકારની આવી નાટ્યસદ્ધશ યોજનાશક્તિના સુખદ પરચાઓ માત્ર અહીં જ નહિ, અન્યત્ર પણ મળતા રહે છે તે નોંધવું જોઈએ.

‘ડાન્સ ઇન્ડિયા’ ડાયાસ્પોરિક વેનમાં રચાયેલી કૃતિ છે. ભારતીયો જે અમેરિકન સંસ્કૃતિથી ઘેરાયેલાં છે તેમની સ્થિતિ Dangling Doldrums જેવી છે. બે સંસ્કૃતિઓ વચ્ચે અથડાતા-અટવાતા આ દાધારણી જીવો માટે સરજાતી ત્રીજી વસ્તુવિકતા સરસ નાટ્યાત્મક પરિસ્થિતિઓનાં આવેખનો વડે પ્રગટ કરી આપતી આ રચનામાં માતા મોનાને દીકરી અમીની ચિંતા થવા માંડે છે કેમ કે તેણે ટી.વી. પર એક ન્યૂઝ્લાન્ડ સાંભળ્યું છે કે ‘સ્ક્રૂલમાં કરાવેલા સર્વેના રિઝલ્ટ મુજબ ૮૮ ઘોરણમાં ભણતા પાંત્રીસ ટકા સ્ટુડન્ટોએ સેક્સનો અનુભવ કર્યો છે.’ (પૃ. ૫૫) દીકરી અમી તો વળી દસમા ઘોરણમાં છે. બોયફેન્ડ પીટર જોડે વીક-એન્ડમાં મુવી જોવા જવાની છે. માતા ટી.વી. ન્યૂઝલ્થી ચિંતિત અને વ્યથિત બની ચૂકી છે. લેખકની ટિપ્પણી જોવા જેવી છે – ‘ડોલરનો સરવાળો,

સંસ્કારોની બાદબાકી, સગવડનો ગુણાકાર અને સમજણનો ભાગાકાર, કઠિન ગણિત... (પૃ. ૫૮) દીકરીની પર્સેમાં બર્થક્રૂરોલની ‘પીલ્સ’ મૂકવા જતી મા, દીકરીની પર્સેમાં પહેલેથી જ ‘પીલ્સ’નું પેકેટ હાજર જોઈ ભડકે છે. ‘એની આંખો પહોળી થઈ ગઈ.’ દીકરી પોતાનાથીએ વધુ ચાલાક, સમજદાર, હોશિયાર નીકળી છે તેનો રહસ્યરસ્કોટ કૃતિને સરસ અંત પાસે પણ લાવી મૂકે છે. કથાસાહિત્યમાં અંતવિધાન પણ કેવો નિષ્ઠાયિક ભાગ ભજવે છે. તેની Frank kermode વડે થયેલી ‘The sense of an Ending’ પુસ્તકમાંની ચર્ચાનું સમરણ કરાવે છે. આ વાર્તાસંદર્ભ ડૉ. નૂતન જાનીએ નોંધ્યું છે તેમ પ્રથમ પેઢીની ગુજરાતી સ્ત્રીઓના અને બીજી પેઢીની એની દીકરી અભી આ બંને પાત્રોની બદલાયેલી માનસિકતા’ (નિરીક્ષક, ૧૬-૧૦-૨૦૧૨ પૃ. ૧૬)નું સંનિવિકરણ નરી સાહિત્યિક પ્રયુક્તિ બનીને અટકી નહિ જતાં સાંપ્રત વાસ્તવિકતાની સચોટ તાસીર પણ પૂરી પાડે છે.

મા-દીકરીની એક બીજી જોડી ‘આરી’ વાર્તામાં પણ નોંધને પાત્ર બની છે. ઘર છોડીને ચાલી ગયેલા પિતા પાછા આવનાર છે. દીકરીને તેમની પ્રતીક્ષા છે પણ માતાએ એકલતાનાં વર્ષોમાં સાચી બારીમાંથી દેખાતી આંખોને જીવન અર્પણ કરી દીધું છે. એક તરફ પિતાનો ગૃહાવેશ થાય છે તો એ જ ક્ષણે માતા ગૃહત્યાગ કરીને ચાલી ગઈ હોય છે. આ બે સામસામી વિરોધી ઘટનાઓ અને વરચે ફસાયેલી દીકરી. આ ત્રણના કોલાજથી વાર્તાકારે ફરી સરસ એકંકીની ક્ષમતા પ્રગટ કરી આપી છે.

વિદેશમાં વસતા દેશીઓની સંકુલ ગતિવિધિઓ, નારીસંવેદનાનું સૂક્ષ્મતા અને સૂઝપૂર્વકનું નિરૂપણ આ રચનાઓનું સબળ જમાપાસું હોવા છતાં સહદ્ય ભાવકને માટે તો એ નરી સામગ્રી જ ગણાય. ભાવકને તો આ બધાનું રસાત્મકતામાં પરિણમે એવું નિર્વહણ થયું છે કે કેમ એની જ શોધ રહેવાની. બધું હોય પણ રસ-પરિણમન ન હોય તો નારીસંવેદના કે ડાયસ્પોરા બધું વાંઝણું રહેવાનું. અહીં રસાત્મક, કલાત્મક પરિણામો અને પરિમાણો સિદ્ધ થયાં છે એ જ વાચક-વિવેચક માટે પ્રદાન ઉપલબ્ધ ગણાવી જોઈએ.

નજરે ચડવવા જેવી વાર્તાઓ : ‘નાતો’ | નવનીત જાની

[નાતો (વાર્તાસંગ્રહ) : મનોહર ત્રિવેદી, લદ્દૂર પ્રકાશન, ભાવનગર, ૨૦૧૦, પૃ. ૧૪+૧૨૮, કિ. ૩. ૧૨૦/-]

‘નાતો’ કવિશ્રી મનોહર ત્રિવેદીનો બીજો વાર્તાસંગ્રહ છે. અગાઉ એમની પાસેથી ‘ગજવામાં ગામ’ (૧૯૮૮) વાર્તાસંગ્રહ મળ્યો છે. નિબંધ, કિશોર-સાહિત્ય અને નવલકથા ક્ષેત્રે એમનું ખેડાણ છે. આસ્વાદ-વિવેચનની પ્રવૃત્તિ પણ કરતાં રહે છે.

કવિતા જેટલું જ એમનું નોંધપાત્ર પ્રદાન વાર્તાસાહિત્યમાં છે. ગોહિલવાડી ગ્રામસંસ્કાર, શિક્ષણમાં ઉત્કટ રસ અને સંવેદનશીલ બોલી સિંચને એમની વાર્તાઓને એમના વ્યક્તિત્વ જેટલી જ સુચારુ બનાવી છે. ‘નાતો’માં દસ વાર્તાઓ સમાવિષ્ટ છે. આઠ

લઘુકથાઓ પુનઃ પ્રગટ કરાઈ છે. સંગ્રહની પ્રસ્તાવનામાં વીનેશ અંતાડીએ કહ્યું છે એમ, વાર્તાકાર વાર્તાવસ્તુને વિશિષ્ટ રીતે મૂકી આપવાની હોથોરી ધરાવે છે.

આ વાર્તાસંગ્રહની ‘જલમટીપ’, ‘પૂછીશ મા’, ‘વઉ’, ‘તંતુ’, ‘નાતો’ અને ‘રફ’ જેવી વાર્તાઓ એમની લેખન-ગ્રૌઢીની સાખ પૂરશે.

‘જલમટીપ’માં લેખક ગોમતીની કથા નિભિતે નદુ મેરાઈની હદ્યસ્થિતિને ચીંધી છે. આખા ગામમાં વગોવાઈ ગયેલી ગોમતીના વસમા જીવનબ્યાપનની વાત કરતા લેખક નદુ મેરાઈની, પતિથી ત્રસ્ત એની સાસરવાણી પુત્રીની વેદનાને વાચા આપે છે. મિત્રો સાથે નદુ મેરાઈને પણ ગોમતીની નિંદા કરવામાં રસ રહ્યો છે. પરંતુ ગોમતીના જીવનમાં સમભાવીપણે ઝાંખતા એમને ગોમતી રખાત નહીં પણ સત્તી જણાય છે. સાસરીમાંથી આવેલો ટીકરીનો પત્ર એમના બદલાતા મનોવલાશમાં અગત્યનો ભાગ ભજવે છે. ગોમતી અને પોતાની પુત્રીમાં અભિન્નતા નિહાળતા નદુ મેરાઈ આસ્વાદ્ય ચરિત્રચિત્રણ પામ્યા છે.

‘પૂછીશ મા’નો મનકો માનાં અવનવાં ક્ષુદ્ર રૂપો જોઈને ત્રસ્ત છે. માના સ્થાન વિશે એના મનમાં અનેક ગડમથલો ચાલે છે. એણે જોયેલાં-સાંભળેલાં માના સ્નેહણ રૂપનો પરિચય ક્યારેય થયો નથી. ‘મા એટલે ? મા એટલે મા. મા એટલે કાંય ને’ જેવી એની મનોસ્થિતિ માની ભાત ભાંતિમાં ફેરવી દે છે. રમલા આગળ એનું ભીતરી વ્યક્તિત્વ યથાતથ પ્રગટ થાય છે.

સુમાજનો એક વર્ગ હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યમાં ખાસ રસ લેતો જોવા મળે છે. પરંતુ માણસાઈના દીવા ક્યારેય હિંદુ-મુસ્લિમ ગોખના ભેદ ભાજી બળતા નથી. ‘નાતો’ વાર્તામાં ‘દૂધ તો પ્રથમીનું અમરત, શું હિંદુનું, શું મુસલમાનનું...!’ જેવી ઉચ્ચ્ય માતૃભાવના વ્યક્ત કરતી સ્ત્રી હીરુ આપણા હદ્યમાં અમીટ છાપ છોડી જાય છે. સરપંચના ઘરે પુત્રજન્મ અને હીરુના ઘરે છ દિવસની પુત્રીનું અવસાન. હીરુ પુત્રીના મૂત્યુનેય રડી શકતી નથી. નરમ હદ્યનો કાસમય કઠળ કણજે પત્નીને કહી દે છે, ‘રોતી નંદી. સરપંચને ન્યાં આજે લાખેણો અવસર, ઈ નો નંદવાય.’ એ જ રાતે મૃત પુત્રીને ઘરના આંગણાના ખૂણથમાં ચૂપચાપ ફંનાવી ટેવાય છે. સરપંચની પત્નીને ધાવજન આવતાં એના પુત્રને હીરુ ધમકાવે છે. માનવતાની આ મિસાલ જેટલી વિરલ છે એટલી સહજ પણ છે. લેખકે આ રજૂઆતમાં થોડોએક દાખડો કર્યો જણાય પણ મૂળ વાત એ કે આવી રીતે ઉછેરેલું સંતાન મા અને ઘરને અવગણો ત્યારે મા ઉપર શું વીતતું હોય છે ?

‘રફ’ વિનોદી શૈલીમાં લખાયેલી સુંદર વાર્તા છે. આપણે ત્યાં આ પ્રકારની વાર્તાઓ ખાસ લખાતી નથી. નીતિન ત્રિવેદીની ‘મનનો રાજા’ તરત યાદ આવે. મન્યાનું વિચિત્ર વર્તન અને જુદી કક્ષાનું ચરિત્ર બનાવે છે. ન કરવાનું કામ કરતા પછડાય અને એ પછડાતમાંથીય

બોધ ન મેળવે એવો મન્યો જાતભાતની અગવીતરાઈ કરતો રહે છે. વાળંદનું કામ જોઈ અસ્ત્રો હાથમાં લેવો, આંખો મીચી સાઈકલ ચલાવવી, ‘બાપુ’ જેમ દાઢી થોભિયા વધારવા જેવી એની રઢ, અંતે જતા એને જ ભારે પડે છે. લેખકે પૂરી તળપદ બોલીવસને પ્રયોજુ આ વાર્તા લખી છે.

‘વહુ’ લેખકની સાવ જુદી વાર્તા છે. કથાયુક્તિની તાજપ અને વિષયવસ્તુની અરૂઢતા આ વાર્તાને વિશેષતા બક્સે છે. વાર્તામાં વાર્તા રચીને લેખકે કથનના વિવિધ આયામો પ્રગટાયા છે. મોટીબા કથી જિસકોલીવાળી વાર્તામાંની ચમત્કર્તા એકલવાયા અને નિર્દોષ એવા કાનાના અભાવને વ્યક્ત કરવા નિમિત્તત્રય બને છે. ભીખાએ આપેલી બકરી સાથે રહેતો કાનો આવા જ કોઈ ચમત્કારની આશાએ પૂછી બેસે છે : આ વાત સાચી હશે ? પમલો, વાર્તાકથક અને એના સાથીદારો બકરી સાથેના કાનાના ફેલિક સંબંધોના સાક્ષી બનતાં કાનાનો પ્રશ્ન વધુ ધારદાર બનીને ઊપરી આવે છે.

‘ડાઘ’ વાર્તામાં ભાઈ-ભાભી-દિયર વચ્ચેના ઉલ્લચિત પારિવારિક સંબંધોનું ચિત્ર મળે છે. ભાઈ-ભાભી ગમડામાં વર્સે છે. ઉદારચરિત મકાનમાલિકે વગર ભાડે ઘર રહેવા આપ્યું છે. એ આંગણાના છોડ અને વાડીનો ઝ્યાલ રાખવાની તાકીદ કરી શહેરમાં ગયા છે. મકાનમાલિકની વાડીએ આંટો મારી આવવા ભાભી લાડકા દિયરને કહે છે એ અક્સમાત જ બાળપણની સખી અને લગ્ન બાદ મા ન બની શકનાર કુમિ સાથે જોડાય છે. વિનીતના દેહ પર પડેલા ઓર્ડિલના ડાઘ કુમિ માટે ઊજળા ડાઘ છે. સમય જતાં એ જ ડાઘ, વિનીતની જેની સાથે સગાઈ થવાની છે એ સત્યાના શરીર પરના ડાઘ સાથે સંનિધિ યોજે છે. વિનીતનો અપરાધબોધ જગ્યા ઉઠતાં એ સત્યાને લખે છે : એક ડાઘ મારી અંદર પડી ચૂક્યો છે, એનું શું ? કોઈને ન કહું તો જીવનભર ન દેખાય, એવો અદશ્ય ડાઘ. હા, એ ડાઘ અન્ય માટે ચંદનલેપ પણ હોય, પરંતુ તારા માટે ? મારા માટે ?” નૈતિક-અનૈતિક અને સમાધાનના મનોદૂંદ્રમાં ફસાયેલાં ત્રણ ચરિત્રોને લેખકે કુશળતાથી પ્રયોજયાં છે. અહીં કુમિ, વિનીત અને સત્યા પક્વ સમજના પ્રતિનિધિ ભાસે છે.

‘તંતુ’ વાર્તા વિશે અગાઉ કહ્યું છે તેમ, ‘એક વાર મોહું જોવા મળે તો, પેલા નોળિયાની પેઠે તાજી થઈ જાઉં’ એવા મતલબનો પત્તિ અને કુટુંબની જિકર કરતો, પત્તિની પૂર્વપ્રેયસી મહિમાનો પગ પોતાના હર્યાભર્યા દામ્પત્યજીવનને રોળીટોળી નાખશે એવા ડરથી ખળભળી ઉઠેલી વાર્તાનાયિકા પત્તિના સૌખ્યાંપૂર્ણ વર્તનને કારણે આત્મનિરીક્ષણમાં ખૂંપે છે. એની સ્વીસહજ ઈર્ઝા સામે પત્તિનો સરળ, નિખાલસ સ્વભાવ પત્તિ ઉપરના વિશ્વાસની ધાર ઓર તેજ કરે છે. પરિણામે, સ્ત્રી જ લઈ શકે એવા નિર્ણય પર એ આવે છે, ‘મોહું જઈશું બાપુને ત્યાં. અત્યારે તો પેલ્લાં ત્યાં જવું છે. ‘દર્શન’માં, મહિમા પાસે...’ મંગલકારી નિકોણ સંબંધથી ઉપર ઉઠતી આ વાર્તા એની નજીકતભરી માવજત

અને અદલ બોલી-લહેકાને લીધે ઊજળી અનુભવાય છે.

આ ઉપરાંત ‘નિર્ણય’, ‘એવું નથી કે...’, ‘આ સિવાયની પણ એક વાત’ જેવી વાર્તાઓ પણ રસપ્રદ છે.

મનોહર ત્રિવેદીની વાર્તાનો એક વિશેષ એવો દેખાયો છે કે, વાર્તાવસ્તુને સંકુલ બનાવવાની એમની પાસે પોતીકી દાઢિ છે. આ એક એવા તળપદ સર્જક છે કે જે પુરોગામી કે સમકાલીન તળપદ વાર્તાઓથી દોરાયા વિના, બહુ દૂર રહીને વાર્તા લખે છે. વળી વાર્તા લખતાં આવડે છે એટલે લખે છે એવુંચ નથી એ બહુ મોટી વાત છે. બોલી, તળપરિવેશ, તળ વસ્તુસામગ્રીનો પૂરો પરિચય, લોકમાનસની નિકટતા એમની વાર્તાસંપદા છે.

‘નાતો’ની વાર્તાઓનો ખરો સ્વાદ ગોહિલવાડી બોલી છે. ગોહિલવાડી બોલીનો શબ્દકોશ બનાવનારને મનોહરભાઈની વાર્તાઓ અચૂક વાંચવી પડે. એવી એની બળકટતા છે. જોકે, કેટલીક વાર્તાઓમાં બોલીની જટાજાળ વાચકને અટકાવે તો નવાઈ નહીં. બોલીનો અતિરેક અને આદર્શવાદી અભિગમથી જોખમાતું વાસ્તવનિરૂપણ - મનોહરભાઈની નજરે ચડશે ?

બાકી, મનોહરભાઈની વાર્તાઓ એક વાર તો અવશ્ય નજરે ચડાવવા જેવી છે જ. એમની વાર્તાઓને નજર ન લાગે એવી શુભકામના સાથે ‘નાતો’નું સ્વાગત.



‘પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા લુપ્ત થવાના આરે’ શીર્ષકથી એક મેઈલ કરાંચીથી આપ્યો છે. ત્યાં વસતા શ્રી બાબુલાલ વાધેલા કોમ્પ્યુટરની મદદથી, ઓનલાઈન તથા વેબસાઈટના માધ્યમથી ગુજરાતી લખતાં-વાંચતાં શીખ્યા છે. એમના મતે કરાંચી (પાકિસ્તાન) શહેરમાં ૧ લાખથી વધારે ગુજરાતીઓ છે, તે ગુજરાતી બોલે તો છે પણ તેમાંથી માત્ર ૭૦૦ લોકો જ ગુજરાતી વાંચી શકે છે. ગુજરાતી લગભગ મૃત-પ્રાય બની રહી છે. એની પાછળ પાછળ ત્યાં ગુજરાતી સંસ્કૃતિ પણ મૃતપ્રાય બની જશે, એ વાતની સખત દહેશાત છે. ગુજરાતી ભાષાને નવું જીવન આપવા માટે એમણે ત્યાં બધાને આગળ આવવા ટહેલ નાખી છે. એમણે કેટલાંક સૂચનો આપણને કર્યા છે, જે નીચે મુજબ છે.

૧. પાકિસ્તાનમાં રહેતા ગુજરાતી નવ્યુવાનોને ગુજરાતમાં શિક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવી.

૨. પાકિસ્તાનમાં આવેલી ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ શરૂ કરાવવો.

૩. પાકિસ્તાનમાં વસતા ગુજરાતીઓને ગુજરાતના જ નાગરિક ગણીને ગુજરાતમાં મળતી શૈક્ષણિક અને અન્ય સેવાઓ પૂરી પાડવી.

૪. પાકિસ્તાનમાં વસતા ગુજરાતી નાગરિકોને સરળતાથી ભારતના વિજા મળે તેની વ્યવસ્થા કરવી.

૫. ગુજરાતી સાહિત્ય પરિષદનું એક એકમ કરાંચીમાં ખોલવું.

૬. પાકિસ્તાનમાં લખાતી અને બોલાતી ગુજરાતી ભાષાના પૃથક્કરણ માટે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પાકિસ્તાન મોકલવા.

૭. લેખકો, પત્રકારો, વ્યવસાયિકોનાં પ્રતિનિધિ મંડળોને સમયોત્તરે પાકિસ્તાનની મુલાકાતે મોકલવાં.

૮. કરાંચી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાનું એકમ શરૂ કરવા માટે સિંધ સરકાર જોડે વાર્તાલાપ આરંભવો.

(આ માહિતી આપવા માટે શ્રી જ્યદીપ ચૌધરી અને ડૉ. જ્યંત મહેતાનો આભાર વ્યક્ત કરું છું.)

હમણા ઈન્દોરના એક પ્રતિષ્ઠિત વેપારી અને સાહિત્યપ્રેમીને મળવાનું થયું. એમનું કહેવું છે કે ઈન્દોરમાં રહેતા અત્યારે ૩૦ હજારથી વધુ ગુજરાતીઓને ભાષાની જરૂરિયાત એક બીજી રીતે ઊભી થઈ છે. ઘણાખરા ગુજરાતી યુવાનો બિનગુજરાતી યુવતીઓ જોડે લગ્ન કરે છે. આ આવેલી નવવધૂઓ ગુજરાતી શીખવા, બોલવા, વાંચવા ઉત્સુક

છે જેથી તે કુટુંબમાં સહજ રીતે ભળી શકે. પણ એવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. એમની જરૂરિયાત છે કે અમારી વહુઓ માટે ગુજરાતીના વર્ગો ચાલુ કરવા છે, તો તમે સહાય ન કરો?

આપણે ત્યાંની વાત કરી જુદી છે. એક વરિષ્ઠ સાહિત્યકારની પૌત્રી ગુજરાતી વાંચી-લખી શકતી નથી. આપણું સાહિત્ય ત્રીજી પેઢીએ વંચાય એ શક્યતા ઓછી થતી જાય છે. એમની કૃતિનો કદાચ અંગેજુમાં અનુવાદ થાય તો પૌત્રી દાદાનું સાહિત્ય રસ હોય તો વાંચી શકે. ઘણી વાર તો એમ લાગે છે આપણે ત્યાં જ જો આવી સ્થિતિ છે તો ભારતના કે પરદેશના પ્રદેશોમાં શું હશે? હજુ તો ગુજરાતમાં કદાચ માંડ પ-દસ ટકા અંગેજ માધ્યમની નિશાળો થઈ છે ત્યાં આ પરિસ્થિતિ છે તો પચાસ ટકા ઉપરની શાળા-કોલેજો અંગેજ માધ્યમની થશે ત્યારે ગુજરાતી ભાષાની, સાહિત્યની અને સંસ્કૃતિની શી દશા હશે?

‘કશું થવાનું નથી’ ‘એમ કરી ભાષા ના મરે’ ‘ભાષા માટેની કાગરોળ નકારી છે’ વરોરે શબ્દો ઘણાખરા ઉન્નતભૂ સાહિત્યકારો કહેતા હોય છે. આપણેય ઈચ્છિયે એ સાચા પડે. પણ પ્રાદેશિક ભાષાઓની સમગ્રપણે જે અવહેલના થઈ રહી છે, ખાસ કરીને તમામ શાસકો દ્વારા થઈ રહી છે, એ જોતાં આ વાત ગંભીર તો છે જ. ‘શાહમૃગ વૃત્તિ’થી આપણે ક્યાં સુધી પીડાતા રહીશું?

પરિષદ અનેક સ્તરે આ માટે સક્રિય છે. પણ આપણી પાસે સક્રિય કાર્યકરો નથી. હમણાં રા. વિ. પાઠકની ‘સાઉન્ડ સિસ્ટમ’ના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે એક સંનિષ્ઠ વેપારી જોડે વાત થતી હતી ત્યારે આપણે એમને કહ્યું “આ સંસ્થા છે. તમે જે ભાષા બોલો છો એને માટે કામ કરે છો. તમારી ગુજરાતી ઓળખ છે એ આ ભાષાના લીધી છે. એને માટે કરી વ્યાજબી રકમ કરો.” અમારા આશર્ય વચ્ચે એમણે ખૂબ ભાવથી કહ્યું ‘તમારે જે રકમ નક્કી કરવી હોય તે કરો.’ એટલું જ નહીં, હવેથી મારી જરૂર હોય ત્યાં મને જોડજો; હું અહીં કહેશો ત્યારે આવીશ, કહેશો એ કામ કરીશ.’’ આ ભાવાત્મકતા એક વેપારીમાં છે; પણ...

૧લી મેથી ઉ મે ગત વર્ષની જેમ રાષ્ટ્રીય પુસ્તક મેળો અ. મ્યુ. કોર્પોરેશન દ્વારા યુનિ. ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં ઉપ૦ જેટલા સ્ટોલ છે. ૨૮ જેટલા વિવિધ કાર્યક્રમોમાં ૧૦૦થી વધુ સાહિત્યકારો, કલાકારો, વિદ્યાનો ઉપસ્થિત રહેશે. એકાદ અપવાદ સિવાય કાર્યક્રમની ગુણવત્તા ઉચ્ચ્ય કક્ષાની રહી છે. આપણા બે પૂર્વપ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશી અને કવિ રાજેન્દ્ર શાહની વંદનાથી મેળાનો આરંભ થશે. મેળાનું બીજ વક્તવ્ય રાષ્ટ્રના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી મનોજ દાસ આપવાના છે. તેમનો વિષય ખૂબ રસપ્રદ છે : ‘The epic Roots of our literature and their Relevance Today.’ જોકે આ પરબ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં મેળો પતી ગયો હશે. કદાચ આપે આ અવસરને માઝયો પણ હશે. ભાષા અને સાહિત્ય માટે વધુ ને વધુ લોકો અભિમુખ થતા દેખાય છે ત્યારે સંતોષની એક લહેર ફરી વળે છે.

ઉત્કૃષ્ટ વાર્તાઓ ફિલ્મના પડદે :

‘પાકિડી’ના ઉપકમે ૨૮ માર્ચની સાંજે આપણા સાહિત્યની બે ઉત્કૃષ્ટ વાર્તા કૃતિઓ પર આધારિત ટૂંકી ફિલ્મોની પ્રસ્તુતિનો કાર્યક્રમ પરિષદમાં ઘોઝાઈ ગયો. ધૂમકેતુકૃત ‘પોસ્ટ માસ્ટર’ અને ઈશ્વર પેટલીકરકૃત ‘લોહીની સગાઈ’ની કથાનું ફિલ્માંકન શ્રી પ્રશાંત સિસોદિયા દ્વારા થયું છે. ડીસા સ્થિત કેટલાંક ભિત્રો સાથે મળીને માતુભાષા પ્રતેના લગાવ તથા સાહિત્યપ્રીતિથી પ્રેરાઈન જ સ્વખર્ય આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. દશ્યરચના, સંવાદી તથા પાર્શ્વભૂમાં થતા બયાન દ્વારા કથાને સાદશ્ય કરવાનો સરાહનીય પ્રયાસ આ ફિલ્મોમાં કરવામાં આવ્યો છે. ગામદું, પોસ્ટઓફિસ, રેલવે સ્ટેશન, દવાખાનું વગેરે લોકેશન્સને તત્કાલીન સમયનો સ્પર્શ આપવાનો પ્રશસ્ય પ્રયાસ અહીં જોવા મળે છે. હિંદર્શક્ની આગવી દસ્તિ તથા કળાસૂઝના પરિણામ સ્વરૂપે કેટલાંક દરથો હદ્યસ્પર્શી બન્યા છે. અલ્લી હોસાના પાત્રમાં રાજુ જોશી અમરતકાડીના પાત્રમાં કોડિલાબહેન ધીયાએ પાત્રાનુરૂપ અભિનય માટે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. મંગુનું પાત્ર ભજવનાર છોકરો ઉર્વસ કોન્ટ્રાક્ટર તથા પોસ્ટ માસ્ટર તરીકે હરેશ રચવાનો અભિનય સામાન્ય સ્તરનો રહે છે. મંગુનું પાત્ર પાગલ કરતાં મંદુછિનું વિશેષ જણાય છે. પ્રસંગાનુરૂપ પાર્શ્વસંગીત ફિલ્મનું સબળ જમા પાસું બની રહે છે. જોકે, પટકથાની શિથિલતા તથા અધિક વર્ણનો ફિલ્મની ચુસ્તતામાં બાધક નીવડે છે. કલાકારો પાસેથી સારી અભિનયક્ષમતાની પણ અપેક્ષા રહે છે. આવી કેટલીક મર્યાદાઓ છતાં વાર્તાઓનું ચલચિત્ર સ્વરૂપે થયેલું આ અવતરણ પ્રશંસનીય છે. જે કૃતિની સિનેમાપ્રેમી સામૃત યુવા પેઢીને આપણા ઉત્કૃષ્ટ સાહિત્યવારસા સન્મુખ કરવામાં સફળ નીવડી શકે. સારી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને હિંદર્શક્ની સર્જનપ્રક્રિયાની રસપ્રદ માહિતી આપી હતી. પ્રેક્ષકોએ પણ ઉમળકાભર્યા પ્રતિભાવ સાથે ફિલ્મસર્જનને વધાવ્યું હતું. હવે પછી દ્વિરેફકૃત ‘મુર્કુંદરાય’ તથા અન્ય શ્રેષ્ઠ વાર્તાઓ પરથી ફિલ્મસર્જન કરવાનો પ્રશાંતભાઈનો દઢ સંકલ્પ આવકાર્ય અને અભિનંદનીય છે.

તા. ૪-૪-૨૦૧૭ના રોજ શ્રી દક્ષાબહેન પટેલે ‘વિદ્યેદ’ વાર્તાનું પઠન કર્યું હતું. શહેરના લોકોમાં રહેલી માનવીય સંવેદનાની ઊંઘપ અને તેથી કામ કરતા નોકરને વેઠવી પડતી અવહેલનાની વાર્તામાં રજૂઆત કરી હતી. આસ્વાદલક્ષી ચર્ચા રસપ્રદ બની હતી. વિશેષ પરમારના અને હરીશ ખત્રીના અવલોકનો નોંધનીય હતાં.

હરીશ ખત્રી

ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત 'પત્રકારત્વ પ્રમાણપત્ર અભ્યાસક્રમ'

(વર્ષ : ૨૦૧૨-૧૩) વિશે પ્રતિબાબ

ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે સતત જાગ્રત એવી પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા છે. તેમની આ નિર્ણાનું એક વધુ ઉદાહરણ એટલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતો પત્રકારત્વ પ્રમાણપત્ર અભ્યાસક્રમ. ગુજરાતના પત્રકારત્વ, ભાષા અને સાહિત્યજગતના વિષય તજ્જીવો (જેવા કે, વિષ્ણુ પંડ્યા, ચિનુ મોહી, પરેશ નાયક, મહિલાલ હ. પટેલ, પ્રહૃત્ય રાવલ, અજય ઉમટ, રમેશ તન્ના, દાસ્ટિ પટેલ, જેલા ઠાકર, વિવેક દેસાઈ, ઈત્યાદિનાં વ્યાખ્યાન દ્વારા ચાલતો આ છમાસિક અભ્યાસક્રમ કોઈ પણ ઊગતા પત્રકાર કે લેખક માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીં પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવે છે. વળી, આ એક પ્રકારનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ હોઈ, નોકરી કરતા નોકરિયાતો કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેમાં કોઈપણ પ્રકારના બંધન વિના જોડાઈ શકે છે. રસપૂર્વક આ અભ્યાસક્રમ પૂર્ણ કરવાથી મને લેખન અને પત્રકારત્વની દસ્તિએ ઘણો લાભ થયો છે. એ માટે હું ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર માનું જ છું, પણ આવું સુંદર આયોજન કરવા બદલ તેમને અભિનંદન પણ પાર્ટવું છું.

- રત્નિલાલ કા. રોહિત

(પત્રકારત્વના વિદ્યાર્થી, વર્ષ : ૨૦૧૨-૧૩)

વિશ્વનાથ મગનલાલ ભણ વ્યાખ્યાનમાળા

તા. ૪-૩-૨૦૧૩ ને સોમવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને એન. એસ. પટેલ કોલેજ, આંશંદના સંયુક્ત ઉપકમે વિશ્વનાથ મગનલાલ ભણ, વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી ભગીરથ બ્રહ્મભણે 'અભિજાત ગીતસ્વરૂપવિચાર' વિશે કોલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કર્યું હતું.

ભગીરથ બ્રહ્મભણે 'અભિજાત ગીતસ્વરૂપ વિચાર' વિશેના વક્તવ્યમાં જણાવ્યું કે અભિજાત ગીતસ્વરૂપનાં મૂળ છેક કંઠસ્થ પરંપરામાં આપણાં લોકગીતોમાં પડેલાં છે. તેમણે ઉર્મિક્વિતાની વિસ્તૃત સમજ આપીને ઉર્મિકાવ્યનાં પદ, ભજન, સોનેટ, ગઝલ વગેરે સ્વરૂપોનો પરિચય આપ્યો હતો અને ગીતસ્વરૂપ અને અન્ય સ્વરૂપો વચ્ચેનો ભેદ દર્શાવ્યો હતો. ગીતસ્વરૂપનાં મુખ્ય લક્ષ્ણાણોની ચર્ચા ગીતોનાં ઉદાહરણ સહિત કરી હતી. ત્યાર પછી ગુજરાતીમાં અભિજાત ગીતસ્વરૂપની વિકાસરેખા દર્શાવી હતી તેમજ વર્તમાન ગીતકવિઓનો પરિચય અને એમનાં ગીતોમાં જોવા મળતું વૈવિધ્ય જુદી જુદી ગીતપંક્તિઓ દ્વારા રજૂ કર્યું હતું.

અનુવાદ-અભિમુખતા

તા. ૮-૪-૨૦૧૩, મંગળવારે મળેલી ‘અનુવાદ-અભિમુખતા’ની બેઠકમાં શ્રી રમેશ ર. દવેએ આગલી બેઠકનો દોર ચાલુ રાખ્યો હતો. આ વખતે તેમણે રોબર્ટ ફોસ્ટની કવિતા ‘stopping by woods’ના સુંદરમુખ, ઉ. જો., નિર્ંજન ભગત, સુરેશ દવાલ વગેરેએ કરેલું ‘કુલ દસ’ અનુવાદ આપ્યા હતા. બેઠકની ચર્ચા માટે તેમણે છેલ્લી ચાર પંક્તિઓ – ‘the woods are lovely –’ નક્કી કરી હતી. અને એ ચાર પંક્તિ હોય તોપણ આગળ-પાછળની પંક્તિના સંદર્ભમાં પણ અનુવાદ થાય તો કેવો થાય ? “છે ભવે આ વનો રૂડાં, શ્વામલ અને ઊરેં...” વળી કવિએ છેલ્લી પંક્તિમાં પુનરૂક્તિ કરી છે તો અનુવાદમાં પણ તેમ કરવું જોઈએ ? એક અનામી અનુવાદકે એ ચાર પંક્તિ આ રીતે કરી છે.

“રમ્ય છે વન તર્ફી ગાઢ શીણો,
પણ અહીં પાળવાં પણ લીધેલાં,
લાખ જોજન તર્ફી મજલ છે કાપવી,
ત્યાં સુધી કયમ કરી લઉં વિસામો ?

આ અનુવાદક કોણ છે ? જો આખું કાવ્ય તેમણે કરેલું હોય, તો તે અને અનુવાદકનું નામ અને કાવ્યનો અનુવાદ મળે તો ‘સાહિત્ય પરિષદ’ના સરનામે મોકલી આપવા માટે રમેશભાઈએ અપીલ પણ કરી છે.

– રૂપા શેઠ

‘અર્વાચીન ગુજરાતી હાસ્યસાહિત્ય’ વિશે પરિસંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત તા. ૨૩-૩-૨૦૧૩ને શનિવારના રોજ ‘અર્વાચીન ગુજરાતી હાસ્યસાહિત્ય’ વિશે પરિસંવાદ યોજાઈ ગયો. પ્રથમ બેઠકમાં પ્રસારમંત્રી નીતિન વડગામાએ પરિસંવાદની ભૂમિકા બાંધી આપી હતી. અકાદમીના મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ પ્રાસંગિક વક્તવ્યમાં હાસ્યસાહિત્યની વિશેષતા ચીંધી આપી હતી. શ્રી વિનોદ ભટ્ટ ગુજરાતી સાહિત્યમાં હાસ્યસાહિત્યની ગતિવિધિની સોદાહરણ ચર્ચા કરી હતી. રઘુવીર ચૌધરીએ બીજરૂપ વક્તવ્યમાં હાસ્યની લાક્ષણિકતાની વાત કરી હતી. તેમણે જયંતિ દવાલ, રમણભાઈ વગેરે હાસ્યસાહિત્યકારોની પણ ચર્ચા કરી હતી. નિર્ંજન ત્રિવેદીએ રઘુવીર ચૌધરીએ કૃત ‘એકલવ્ય’ વિશે, હસ્તિ મહેતાએ બજુલ ત્રિપાઈકૃત ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈની’ વિશે, પાતુલ કંદર્પ દેસાઈએ સ્વાગત કરીને પરિસંવાદના મહત્ત્વ વિશેની ચર્ચા કરી હતી. ઉદ્ઘાટન-બેઠકનું સંચાલન પણ તેમણે કર્યું.

પરિસંવાદની બીજી બેઠકમાં પ્રફુલ્લ રાવલે નવનીત સેવકકૃત ‘પ્રાંગંત્રિ’ વિશે, રત્નિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટકૃત ‘વિનોદની નજરે’ અને હરિકૃષ્ણ પાઠકે નાથાલાલ દવેકૃત ‘ઉપદ્રવ’ વિશે તેમજ કલ્યાન દેસાઈએ ‘છેલ્લા દાયકાનું હાસ્યસાહિત્ય’ વિશે

વક્તવ્યો આચ્છાદના પ્રસારમંત્રી શ્રી જનક નાયકે સમાપન-વક્તવ્ય આપ્યું હતું.
ઉપસ્થિત હાસ્યસાહિત્યના ભાવકોએ પરિસંવાદની મજા માણી હતી.

પરિષદ્ધના આગામી કાર્યક્રમો

માતૃભાષા વ્યાખ્યાનશૈલી

તા. ૨૧-૫-૨૦૧૩ના રોજ રત્નલાલ બોરીસાગર અનુસ્વાર વિશે વક્તવ્ય આપશે. સાંજે
૬.૦૦ કલાકે.

વિશે કવિતા કેન્દ્ર

તા. ૧, ૮, ૧૫, ૨૨, ૨૮ મે – ૨૦૧૩ના રોજ સાંજે ૭.૦૦ કલાકે બુધસભા.

જ્યંતિ એમ. દલાલ વ્યાખ્યાન

જ્યંતિ એમ. દલાલ વ્યાખ્યાન અંતર્ગત તા. ૨૫-૫-૨૦૧૩ના રોજ શ્રી મધુસૂદન
કાપડિયાની ઉપસ્થિતિમાં તેમના પુસ્તક ‘અમેરિકાવાસી ગુજરાતી સર્જકો’ ઉપર વક્તવ્યો
શ્રી રમણ સોની અને શ્રી વિનોદ જોશી આપશે. સાંજે ૬.૦૦ કલાકે.

વિશ્વકોશની શ્રી ભદ્રકર વિદ્યાર્થીપદ જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન-શૈક્ષણિક અંતર્ગત શ્રી પ્રીતિ સેનગુપ્તાએ 'વિશ્વપ્રવાસ' અનુભૂતિ અને આધ્યાત્મિક વિશે વક્તવ્ય આપ્યું.

શ્રી ધ્રુવ ભણને ધનજી કાનજી ગાંધી ચંદ્રક

ગુજરાત સાહિત્ય સભા તરફથી ૨૦૧૧નો ધનજી કાનજી ગાંધી ચંદ્રક શ્રી ધ્રુવ ભણને કથાસાહિત્યના સર્જનને અનુલક્ષીને એનાયત થયો. તા. ૧૬ માર્ચ ૨૦૧૩ના રોજ શ્રી હીરાલાલ ભગવતી સભાગુહમાં ગુજરાત સાહિત્યસભાના પ્રમુખ શ્રી કુમારપાળ દેસાઈના વરદ હતે આ ચંદ્રક તેમને અર્પણ થયો. આ પ્રસંગે શરીરજી વીજળીવાળાએ ધ્રુવ ભણની નવલકથાઓ વિશે વાત કરી. શ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું કે ધ્રુવ ભણનું દર્શન કોઈ ગ્રંથથી બાદ નથી, કોઈ સ્વરૂપથી સંકોચાયું નથી. એ સધગાથી સર્વથા મુક્ત એવા સર્જકાદેશ, પ્રકૃતિ અને પ્રજાજીવનની મહેકને મસ્તીથી માણે છે. શ્રી ધ્રુવ ભણ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે હું તો એક લેખક છું. મારું લખવાનું જુદી રીતે એટલા મારે છે કે મેં જોયું છે તે હેમેશાં તરત જ બીજાને કહેવાનું મન થાય. મારી કથામાં નાયિકાઓ સમર્થ હોય છે. જે કંઈ થાય અને મને સ્પર્શો તે લખ્યા વગર નથી રહેવાતું તેમણે આ ચંદ્રકનો સહર્ષ સ્વીકાર કર્યો. સર્વશ્રી ઉષાબહેન ઉપાધ્યાય અને શ્રદ્ધાબહેન ત્રિવેદીએ 'ગુજરાતના સારસ્વતો' વિશે વાત કરી. શ્રી પ્રકુલ્પ રાવલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. શ્રી યોગેશ જોધાએ આભારવિધિ કરી. ધીરુભાઈ ઠાકરે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી તૈયાર થયેલ અને શ્રદ્ધાબહેન ત્રિવેદી, પ્રતિભા શાહ અને કીર્તિદા શાહ સંપાદિત 'ગુજરાતના સારસ્વતો' ગ્રંથ. ૧નું વિમોચન કર્યું અને તેમણે કહ્યું કે ગુજરાત સાહિત્યસભા એક ઉત્તમ કોટિની સંસ્થા છે. તેમણે આ સંસ્થા તરફથી થતાં કાર્યોની વાત કરી.

સાર્થ ગુજરાતી જોડણીકોશ વિશે

ગુજરાત વિદ્યાર્થ તા. ૧૦-૧-૧૧૮૮૮થી મુ. શ્રી મોહનભાઈ પટેલની અધ્યક્ષતા ડેઢા સાર્થ ગુજરાતી જોડણીકોશની આજના સંદર્ભમાં શુદ્ધિવૃદ્ધિ કરવાનું કામ કરતી રહી છે. એ કામ એકધારું મોહનભાઈના અવસાન પછી પણ ચાલતું રહ્યું છે અને તેમાં ગુજરાતના ભાષાસાહિત્ય તેમજ શિક્ષણસંસ્કાર ક્ષેત્રના અગ્રણી વિદ્યાનોનો લાભ લેવાનો અભિગમ રાખ્યો છે. એ કામને વધુ વેગ મળે, ચોક્કસ દિશા મળે, એ કામમાં વધુ અસરકારકતા સાધી શકાય એવા ઘ્યાલથી અનેક વિદ્યાનોનો સહકાર મેળવવાનો પ્રયત્ન ચાલતો રહ્યો છે.

એ પ્રયત્ન હવે આ સાર્થ ગુજરાતી જોડણીકોશની અંતિમ તબક્કાની કામગીરીમાં વધુ સઘન રીતે કારગત નીવડે એ માટે અમને આપ સૌનાં સૂચનો મળતાં રહે એ જરૂરી છે. આ દિશામાં આપ રચનાત્મક રીતે અમને સાથ અને સહકાર આપો એવી સાગ્રહ વિનંતી છે. આ પત્ર મળ્યે તા. ૩૦-૪-૨૦૧૩ સુધીમાં આપ આપનાં નક્કર સૂચનો અમને લખી મોકલશો

તો તે અમને ખૂબ ઉપયોગી થશે. જેટલાં સૂચનો મળશે તેની જોડણીકોશની સમિતિ સમીક્ષા કરશે અને શુદ્ધિવૃદ્ધિ અંગેના પ્રયત્નો પૂરા કરશે.

**આચાર્ય ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિના અમૃતપર્વ
અભિવાદન સમારોહમાં ગ્રંથત્રયીનું લોકપર્ણશ**

મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃતના વિદ્ધાન તરીકે સન્માનિત અને પુરસ્કૃત ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિનો અમૃતપર્વ અભિવાદન સમારોહ વિવિધ સંસ્થાઓ, અધ્યાપકો અને શુભેચ્છકોના ઉપકમે દેંતાવીના પૂ. સ્વામી સાચ્ચિદાનંદજી મહારાજની નિશ્ચામાં અને હેમ. ઉ. ગુજ. યુનિવર્સિટી, પાટણનાં કુલપતિશ્રી ડૉ. હેમાક્ષી રાવની અધ્યક્ષતામાં મહેસાણના કમળાબા હોલમાં ઊજવાયે. આ પ્રસંગે સર્વશ્રી સિતાંશુ યશશ્વર, કુલીનચંદ્ર યાણીક, ડૉ. વી. કુટુંબ શાસ્ની વગેરે વિદ્ધાનોએ વક્તવ્યો આપ્યાં હતાં.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ અંતર્ગત

કવિશ્રી પ્રીતમ લખલાણી (યુ.એસ.એ.) સર્જક ડેફ્ઝિયત અને સ્વરચિત કાલ્પોનનું પઠન તેમજ, અરવિંદ વેગડાનો કાવ્યસંગ્રહ ‘ઝીબા કોસિંગ’, પ્રવીણ ગઢવીનો કાવ્યસંગ્રહ ‘poet’s voice’, કાન્તિલાલ પરમારની નવવલકથા ‘વજ્ઞાબાર’ અને ગુજરાતી દલિત કવિતાનું સંપાદન ‘બ્રેનવોશ’નો વિમોચન સમારોહ રધુવીર ચૌધરીની અધ્યક્ષતામાં તા. ૭-૪-૨૦૧૩, રવિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિભવનમાં યોજાયો હતો. જેમાં સર્વશ્રી અતુલ પરમારે, કિશોરસિંહ સોલંકીએ, પ્રવીણ ગઢવી અને રધુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં હતાં.

સ્રિમતા પારેખ સાહિત્ય સ્પર્ધાની રૂપરેખા અને શરતો

૧. અભિલ હિંદ મહિલા પરિષદ બૃહદ્દ સુરત શાખા ટ્રસ્ટ વાચકમંચના ઉપકમે સ્રિમતા પારેખ સાહિત્ય લેખનસ્પર્ધા યોજવામાં આવે છે. તેમાં દર વર્ષ વાર્તાલેખન, કાવ્યલેખન (કાવ્યના સર્વ પ્રકારો) અને બાળવાર્તાલેખન એમ ત્રણ પ્રકારની સ્પર્ધાઓ કરવામાં આવશે.

૨. ત્રણે પ્રકારની શ્રેષ્ઠ કૃતિને પારિતોષિક આપવામાં આવશે.

૩. ગુજરાતીમાં લખતા અને ગુજરાતમાં વસતા સર્જકો માટે આ સ્પર્ધા યોજાશે.

૪. દરેક પ્રકારની કૃતિની મહત્તમ શર્બદમર્યાદા નીચે પ્રમાણે રહેશે.

વાર્તા-૨૦૦૦ શર્બદો, કવિતા-૧૪ પંક્તિ, બાળવાર્તા-૧૫૦૦ શર્બદો

૫. દરેક કૃતિને શીર્ષક આપવું જરૂરી છે.

આ અંગે વધુ માહિતી માટે પ્રજ્ઞા વશીનો સંપર્ક કરવો.

પ્રજ્ઞા વશી (૮૨૨૮૩૩૧૧૫૧)

કન્વીનર-વાચકમંચ

અ.હિ.મ. પ. બૃહદ્દ સુરત શાખા

શ્રદ્ધાંજલિ

(૧) ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સમ્ભ્ય અને કવિ, વાર્તાકાર શ્રી ડાલ્યાબાઈ

પટેલ 'માસૂમ'નું તા. ૨-૩-૨૦૧૭ના રોજ ફુંખદ અવસાન થયું સાહિત્યિક પ્રવૃત્તિઓના એક સાક્ષી કાર્યકર અને ગુજરાતી સાહિત્યના એક સર્જકને ગુમાવવાનો શોક વેરી વળ્યો. પરિષદ એમને ભાવભરી શ્રદ્ધાજલિ અર્પે છે.

(૨) કવિ પ્રો. મંગળ રાડોડનું તા. ૧૨-૩-૨૦૧૭ના રોજ મુંબઈમાં નિધન થયું. સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાંથી ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેમણે કાવ્યસંગ્રહો 'બાગમાં', 'કાષ્ઠશિલ્પ', 'પ્રશ્નોપનિષદ્ધ' અને 'સહજોપનિષદ્ધ' આપ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એમને ભાવભરી શ્રદ્ધાજલિ અર્પે છે.

૧૮

પરબ


ગુજરાતી સાહિત્ય પરિષદના સત્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- ^૧/_{૧૭૫૦} 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
- ^૧/_{૧૭૫૦} 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સત્યપદમાં ગમે ત્યારે થઈ શકાય છે.
- ^૧/_{૧૭૫૦} 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.
- ^૧/_{૧૭૫૦} વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.
- ^૧/_{૧૭૫૦} ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સત્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
- ^૧/_{૧૭૫૦} માર્ગરિષદના વાર્ષિક વ્યક્તિગત સત્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સત્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
- ^૧/_{૧૭૫૦} માર્ગરિષદના આજીવન સત્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સત્ય ઝી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવારીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
- ^૧/_{૧૭૫૦} 'પરબ' લવાજમ તથા પરિષદ સત્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

લેખકોને :

- ^૧/_{૧૭૫૦} 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
- ^૧/_{૧૭૫૦} લેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા ઽંજ સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અસ્કરે લખી મોકલવું, પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ કે ચબરખીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.
- ^૧/_{૧૭૫૦} લેખીકૃત કૃતિની જાણ કરાશે. ટાલ-ટિકિટો ચોંટાટેલું કવર મોકલવું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલવું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.
- ^૧/_{૧૭૫૦} માત્રબ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ણનભવન, આશ્રમમાર્ગ, 'યાઈમ્સ' પાછળ, નાનીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત તદ્દન નવાં પ્રકાશનો



ગુજરાતી કવિતાચયન : ૨૦૧૧ : યોસેફ મેકવાન
પ્ર. આ. ૨૦૧૨, ડિમાઈ, કાચું પૂર્ણ, પૃ. ૧૩૪+૨૨,
ક્ર. રૂ. ૧૨૦/-]

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૯૭ની
પ્રતિ વર્ષે 'કવિતાચયન'નું પ્રકાશન થાય છે.
ગુજરાતી કવિતાચયનની કાવ્યાત્મામાં કાન્ત-
બળવંતરાય શતાબ્દી ગ્રંથમાળાનો આ ૨૧મો
મણાડો છે. 'ગુજરાતી કવિતાચયન : ૨૦૧૧'ના
સંપાદક શ્રી યોસેફ મેકવાને વર્ષ દરમિયાન
ગુજરાતી ભાષાના વિવિધ સામયિકમાં પ્રસિદ્ધ
થયેલી કવિતાઓમાંથી કવિતાનું સંપાદન કર્યું છે.

આ સંપાદનકાર્ય દ્વારા સંપાદક યોસેફ મેકવાને તત્કાલીન સમયમાં રચ્યાતી ગુજરાતી
કવિતાની તાસીરથી ગુજરાતી ભાષાસાહિત્યના રસિકોને અવગત કરાવ્યા છે.
ગુજરાતી ભાષાસાહિત્યના ભાવકો આ સંપાદનને ઉખાભર્યો આવકાર આપશે એવી
આશા છે.

ઓહવાટ : લે. દીના પંડ્યા, પ્ર. આ. ૨૦૧૨ ડિમાઈ

ગુજરાતી સાહિત્ય પરિષદ

નદીકિનારે, 'થાઇમ્સ' પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮.

ફોન : ૨૬૫૮૭૯૪૭